



### ગંભીર પૂરને કારણે બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ સલામતીથી ચર્ચવિલ વિસ્તારમાંથી રહેવાસીઓનું સ્થળાંતર કરી રહ્યા છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (17 ફેબ્રુઆરી 2022) – સીટી ઓફ બ્રેમ્પટન ચર્ચવિલ વિસ્તારમાં આવેલ ગંભીર પૂરની સ્થિતિ સામે લડત આપી રહ્યા છે અને પીલ રિજનલ પોલિસ સાથે બાકી રહેલ રહેવાસીઓને સલામત રીતે સ્થળાંતર કરવા માટે કામ કરી રહ્યા છે.

- ચર્ચવિલ રોડના વિશેષ વિસ્તારો
- માર્ટિન્સ બૂલવર્ડ
- ચર્ચ સ્ટ્રીટ
- વિક્ટોરિયા સ્ટ્રીટ
- એડિલેડ સ્ટ્રીટ
- ક્રેડિટવ્યુ રોડના વિશેષ વિસ્તારો

મોટાભાગના રહેવાસીઓનું આ વિસ્તારમાંથી પહેલાથી જ સ્થળાંતર કરવામાં આવ્યું હોવા છતાં, આ સ્થળાંતરની જરૂરિયાત આખી રાત રહેશે અને આવતીકાલે પુનઃ આકારણી કરવામાં આવશે. બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ, બ્રેમ્પટન ઈમર્જન્સી મેનેજમેન્ટ ઓફિસ, બ્રેમ્પટન પબ્લિક વર્ક્સ, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ, પીલ રિજનલ ઓફિસ, રિજન ઓફ પીલ હ્યુમન સર્વિસિસ એન્ડ ક્રેડિટ વેલિ કન્ઝર્વેશન સ્થળ પર હાજર છે અને સંજોગોનો સામનો કરવા દેખરેખ રાખી રહ્યા છે.

જો રહેવાસીઓ ખતરાનો સામનો કરે તો તેમણે તાત્કાલિક 9-1-1 પર ફોન કરવો. નગરપાલિકાના રસ્તા પર સ્થાનિક પૂર, અવરોધિત સ્ટોર્મ સિવર ગ્રેટ અથવા બેઝમેન્ટમાં પાણી ભરાયા હોય ત્યારે 3-1-1 પર ફોન કરવો.

#### પૂર સલામતી સૂચનો

એન્વાયર્મેન્ટ કનેડાએ બ્રેમ્પટન માટે વિશેષ હવામાન નિવેદન જાહેર કર્યું છે જેમાં આવતીકાલે સવારે વરસાદની આગાહી, થીજી જતા વરસાદ અને બરફ અંગેની માહિતી છે. ક્રેડિટ વેલિ કન્ઝર્વેશને પણ પૂરની ચેતવણી જારી કરી છે.

રહેવાસીઓને આ સલામતીની સાવચેતીઓ લેવા જણાવવામાં આવે છે.

- સ્થિર પાણીમાં ઘરની અંદર રહેલા વિદ્યુત ઉપકરણો અને ભૂગર્ભના અથવા નીચે રહેલી પાવરની લાઈન્સને કારણે વિદ્યુત ચાર્જની હાજરી હોઈ શકે છે. નીચે પડેલી પાવર લાઈન્સ અને ભરાયેલા સ્થિર પાણીથી પોતાની જાતને, બાળકો અને પાળેલા પશુને દૂર રાખશો.



- પૂરના પાણી ઝડપથી આવી શકે છે અને તેમા ડૂબી જવાનું જોખમ છે. પોતાની સલામતી રાખવી અને પૂરના પાણીમાંથી ચાલવું કે વાહન ચલાવવા નહીં.
- મકાનના માળખા અસરગ્રસ્ત થઈ શકે અને અસુરક્ષિત બની શકે. સંભવિતપણે મકાનના પાયા કે માળખામાં કોઈપણ માળખાકીય નુકસાનના ચિહ્નો દેખાય તો પોતાના ઘરમાંથી દૂર થઈ જવું જેમાં સામેલ છે પોર્ચની છત અને લટકતી છતો.
- પૂરના પાણીથી ઘણી વખત માર્ગો અને વોકવેઝનું ધોવાણ થતું હોય છે. માર્ગો નબળા પડ્યા હોય તેમ અને અને કારના વજનથી ભાંગી પડી શકે છે. પૂરના પાણીમાં ચાલવું અથવા વાહન ચલાવવા નહીં.
- પૂરના પાણીમાં ગટરના પાણી (જેમાં બેક્ટેરિયા, વાયરસ કે પરજીવીઓ સમાયેલા હોઈ શકે), રસાયણો અને કાચના ટુકડા જેવો કચરો હોઈ શકે. નીચાણવાળા વિસ્તારોને ટાળો. પૂરના પાણીથી પોતાની જાતને, બાળકો અને પાળેલા પશુને દૂર રાખશો.
- પૂર વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં સિવાયકે ઉચિત વ્યક્તિગત સુરક્ષાત્મક સાધનો અને પહેરવેશ પહેર્યો હોય.

અઘતન અપડેટ્સ માટે રહેવાસીઓએ Twitter પર [@BEMOPrepared](https://twitter.com/BEMOPrepared) ને ફોલો કરવું અને પૂર સલામતીની માહિતી માટે [www.brampton.ca](http://www.brampton.ca) ની મુલાકાત લેવી.

-30-

### મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)